

# ભારતીય જનતા પાર્ટી

## ગુજરાત પ્રદેશ

### શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

પ્રેસનોટ

તા.૦૫.૧૧.૨૦૧૯

“ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ બીલ” (ગુજકોક) ખરડાને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહની ઈચ્છાશક્તિને વંદન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી

ગુજરાતની સાડા છ કરોડ જનતાની સુરક્ષા-સલામતી વધુ સુનિશ્ચિત કરવા બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજનો આભાર વ્યક્ત કરુ છું. - શ્રી જીતુભાઈ વાઘાણી

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી (RCEP) માં ન જોડાવવાનો સાહસિક અને ઐતિહાસિક નિર્ણય લઈને ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના માટે દેશહિત જ સર્વોપરિ છે. - શ્રી જીતુભાઈ વાઘાણી

ભાજપા માટે સત્તા એ ભોગવિલાસનું સાધન નહીં પરંતુ રાષ્ટ્રહિતને સર્વોપરિ માની ભારતને વધુ સમર્થ અને શક્તિશાળી બનાવવાના મહાયજ્ઞમાં સહભાગી થવાનું માધ્યમ છે. - શ્રી જીતુભાઈ વાઘાણી

‘મહા’ વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખતા ગુજરાત ભાજપાના સૌ કાર્યકર્તાઓને વહીવટી તંત્ર સાથે સંકલન સાધી પ્રભાવિત વિસ્તારની જનતાને સંભવ દરેક સહાય પૂરી પાડવા તથા આપત્તિની આ ઘડીમાં સાથી નાગરિકો સાથે અડિખમ ઉભા રહેવા માટે અપીલ કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી

‘મહા’ વાવાઝોડાની આ વિકટ પરિસ્થિતિમાં રાજ્યના નાગરિકોને અફવાઓ ઉપર ધ્યાન આપ્યા સિવાય પ્રશાસન દ્વારા અપાયેલ સૂચનોનો અમલ કરવા વિનંતી કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી

પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ “ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ બીલ” (ગુજકોક) ખરડાને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહની ઈચ્છાશક્તિને વંદન કર્યું હતું અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજનો આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજકોક કાયદાને મંજૂરી મળતા ગુજરાતની સાડા છ કરોડ જનતાની સુરક્ષા-સલામતી વધુ સુનિશ્ચિત થશે અને સુરક્ષિત ગુજરાત વધુ સુરક્ષિત બનશે. ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વોને ગુજકોકના અમલમાં આવ્યા બાદ આકરી સજા મળશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

# ભારતીય જનતા પાર્ટી

## ગુજરાત પ્રદેશ

### શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

..૨..

શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી (RCEP)માં ન જોડાવવાનો સાહસિક અને ઐતિહાસિક નિર્ણય લઈને ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના માટે દેશહિત જ સર્વોપરિ છે. (RCEP)માં ન જોડાવવાના નિર્ણયથી દેશના ખેડુતો, પશુપાલકો, લઘુ અને મધ્ય ઉદ્યોગ, દૂધ-ડેરી ઉદ્યોગ તથા ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે, બીનજરૂરી આયાત અટકશે તથા ડેટા સુરક્ષા વધશે. ભાજપા માટે સત્તા એ ભોગવિલાસનું સાધન નહીં પરંતુ રાષ્ટ્રહિતને સર્વોપરિ માની ભારતને વધુ સમર્થ અને શક્તિશાળી બનાવવાના મહાયજ્ઞમાં સહભાગી થવાનું માધ્યમ છે.

શ્રી વાઘાણીએ 'મહા' વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખતા ગુજરાત ભાજપાના સૌ કાર્યકર્તાઓને વહીવટી તંત્ર સાથે સંકલન સાધી પ્રભાવિત વિસ્તારની જનતાને સંભવ દરેક સહાય પૂરી પાડવા તથા આપત્તિની આ ઘડીમાં સાથી નાગરિકો સાથે અડિખમ ઉભા રહેવા માટે અપીલ કરી હતી.

શ્રી વાઘાણીએ 'મહા' વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના નાગરિકોને ઉચાટમાં ન આવવા માટે અનુરોધ કર્યો હતો તથા અફવાઓ ઉપર ધ્યાન આપ્યા સિવાય પ્રશાસન દ્વારા અપાયેલ સૂચનોનો અમલ કરવા પ્રભાવિત વિસ્તારના રહીશોને વિનંતી કરી હતી અને ગુજરાત આખું સાથે મળીને કુદરતી પડકારની આ સ્થિતિને પહોંચી વળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

(પ્રશાંત વાળા)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ